

Ref: No. ABCL/SD/MUM/2024-25/SEPTEMBER/10**20 September 2024****BSE Limited**

Corporate Relations Department
1st Floor, New Trading Ring,
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai 400 001

Scrip Code: 540691**Scrip ID: ABCAPITAL****The National Stock Exchange of India Ltd**

Exchange Plaza, 5th Floor,
Plot. C/1, G-Block, Bandra-Kurla Complex,
Bandra (East),
Mumbai 400 051

Symbol: ABCAPITAL**Dear Sir/ Madam,****Sub: Intimation regarding publication of newspaper notice to shareholders**

Please find enclosed copy of the notice to shareholders published on 20th September 2024 in Business Standard (All Editions) and Sandesh Rajkot Edition for transfer of sale proceeds arising from sale of fractional shares of Aditya Birla Capital Limited to Investor Education and Protection Fund and furnishing of PAN and KYC details by holders of physical securities.

The same is made available on the Company's website at the following web link:
<https://www.adityabirlacapital.com/investor-relations/announcements-and-updates>.

The above is for your information, records and dissemination please.

Thanking you,

Yours sincerely,

For **Aditya Birla Capital Limited**

Santosh Haldankar
Company Secretary & Compliance Officer
Encl.: As above

RETURNS FROM THE NATIVES

As Prime Minister Modi begins another US trip tomorrow, a look at how the diaspora matters more than ever



Prime Minister Narendra Modi (top) during the 'Howdy, Modi' event at NRG Stadium, Texas, in September 2019; Congress leader Rahul Gandhi (above) interacting with students and faculty at Georgetown University, Washington DC, in September 2024

ARCHIS MOHAN
New Delhi, 19 September

In an interview in January 2015, a month before the Aam Aadmi Party (AAP) spectacularly swept the Delhi Assembly polls, party chief Arvind Kejriwal conceded in an interview to a news agency that Prime Minister Narendra Modi's "appeal" had "affected" his party's diaspora support.

Until then, for Kejriwal and his associates, who launched AAP in November 2012, support from the Indian diaspora, especially Indian Americans, was substantial to its coffers and its election campaigning. A United Progressive Alliance government probe in early 2014 found that almost a fifth of the funds AAP raised through crowdsourcing came from non-resident Indians (NRIs).

As Gujarat's chief minister, Modi had maintained a sustained outreach to NRIs, particularly the financially influential Gujarati diaspora in the US, since nearly a fourth of the 5.4 million Indian Americans trace their roots to Gujarat. With the US denying him a visa, Modi took to addressing the Gujarati diaspora events via video link, such as the World Gujarati Conference and Gujarat Divas celebrations.

During his tenure as Gujarat CM, the state government started holding the annual Vibrant Gujarat Summit, where it hosted investors from across the world, including Gujaratis living abroad. In the run up to the 2014 Lok Sabha polls, the US offshoots of the Overseas Friends of the Bharatiya Janata Party (OFBJP) and Hindu Swayamsevak Sangh helped Modi's election campaign, reaching out to other linguistic communities among Indian Americans.

10 years of MSG

Beginning with his first visit to the US as prime minister in September 2014, when he addressed 20,000 Indian Americans at New York's Madison Square Garden (MSG), until his eighth in June 2023, Modi has attended at least half dozen diaspora events in that country, including the "Howdy Modi" event in Houston in 2019, which US President Donald Trump attended.

On Sunday, an event that will mark 10 years of his MSG address and his return as India's PM for a third successive occasion, Modi will address Indian Americans at the Nassau Veterans Memorial Coliseum in Long Island. The event is titled, "Modi and US: Progress Together". On Thursday, Foreign Secretary Vikram Misri

described the Indian American community as a "living bridge" between India and the US.

Organisers of the event have said that over 24,000 people have registered for the event, while the venue's seating capacity is only 15,000. The Indo-American Community of USA, the organiser of the event, has stressed that it is "committed to making the event as inclusive as possible".

Earlier in the month, Congress leader Rahul Gandhi was in the US, addressing university students and interacting with journalists. The Congress party and Gandhi were late in galvanising its overseas arm, the Indian Overseas Congress, to reach out to its supporters among the Indian diaspora in the US. But its engagement with diverse Indian American religious and linguistic communities has become more cohesive in the last few years. Both Modi and Gandhi's visits to the US come with the presidential elections less than two months away.

As for AAP, its support base across the diverse Indian American communities might have dwindled since 2013-14. It had successfully galvanised Punjabis living in the US, UK and Canada for its 2022 Punjab Assembly poll campaign. The Punjabi community in these countries had also rallied in support of the farmers' protest of 2020-21 against the three central laws.

Outsized impact

The Ministry of External Affairs estimates that Indian Americans are 5.4 million strong, including 2.07 million NRIs and 3.33 million People of Indian Origin, or PIOs. In contrast, 3.6 million NRIs are in the United Arab Emirates and 9.5 million Indians, mostly blue collar workers, live and work across West Asia. They also contribute the largest share to India's remittances.

But, a report released in June this year by Indiaspora, a US-based non-profit organisation, with help from Boston Consulting Group, notes that Indian Americans are wealthier, better qualified, and despite being a mere 1.5 per cent of the total population of the US, and by virtue of living in a democratic country, continue "to have an outsized impact on multiple aspects of American life, from the economics to the cultural".

The report titled, 'Small Community, Big

WHY INDIANS MATTER IN US

5.1 mn Indian Americans comprised the Indian diaspora (those born in India and in the US) as of 2020

- Of these, **2.8 mn** are first-generation immigrants, according to Migration Policy Institute
- 30%** of the 5.1 mn migrated to the US before 2000, **45%** after 2010
- 78%** of Indian Americans hold bachelor's degree or higher (US national average is 36%)
- 320,000** work visas issued to Indian diaspora in 2022-23, which is **73%** of all work visas by the US
- Median income is **\$136,000** (almost double the US population average)
- Indian-origin CEOs helmed 16 Fortune **500** companies in 2023 (3%)
- Of the **358** unicorns in the US founded by first-generation immigrants in 2018-23, **72** (20%) have Indian migrants as founders or co-founders
- 60%** of all US hotels are owned by members of the diaspora
- Indian Americans own **35%-50%** of all convenience stores in the US
- Indian diaspora, **1.5%** of US population, contributes **5-6%** (\$300 billion) in tax revenues annually to the US federal coffers
- In addition, they record **\$370-\$460 billion** in annual spending
- Under the FCRA, donations from the US to India increased from **\$782 million** in 2015-16 to **\$831 million** in 2018-19
- Indian Americans' presence in successive US administrations increased from **1.7%** in 2013 to **4.4%** in 2023, with over 150 Indian Americans in pivotal roles in 2023, including Vice President Kamala Harris

Source: Small Community, Big Contributions, Boundless Horizons report

Contributions, Boundless Horizons', documents the Indian Americans' role across politics, business, academia, and culture. It finds that nearly 78 per cent of Indian Americans hold bachelor's degrees or higher, which is more than twice of the US national average of 36 per cent. The median income of Indian Americans (2020 data) is \$136,000, which is almost double that of the US population.

It says the Indian diaspora, with its median age being 36, is young, lives in multigenerational homes, where Indian identity and traditions remain strong, helping its growing influence on the broader US culture. According to the report, 60 per cent of all US hotels are owned by members of the diaspora. It also controls an estimated 35 to 50 per cent of all convenience stores in the US, which generate \$350-\$490 billion in revenues each year.

The Indian diaspora contributes 5 to 6 per cent (\$300 billion) in tax revenues annually to the US federal coffers, 25 per cent of international students to the US each year are of Indian origin and one in every 10 physicians in the US is an Indian American. As the report documents, this financial heft has influence not just in the US social sphere but also in India.

For example, donations from the US to India under the Foreign Contribution (Regulation) Act (FCRA) increased from \$782 million in 2015-16 to \$831 million in 2018-19. Donations from the US are 35 per cent of all FCRA donations, the largest from any country. Notable contributions in 2022 were by the Rural India Supporting Trust (\$39 million), Pratham USA (\$17 million) and Rashtriya Swayamsevak Sangh-affiliated Ekal Vidyalaya Foundation (\$10 million).

Remittances from the US to India accounted for \$26 billion, or 23 per cent of the total remittances of \$113 billion that India received in 2022-2023. Diaspora connections have also helped across sectors, especially in advanced innovation and scientific research. Since the turn of the century, US companies have invested \$63 billion in FDI in India, while Indian companies have invested more than \$40 billion in the US, creating 426,000 jobs in that country, according to the Confederation of Indian Industry.

Indian Americans, in recent decades, have also come to play an important role in American politics. This includes Vice President Kamala Harris and other leading politicians such as Nikki Haley, Pramila Jayapal, and Vivek Ramaswamy.

The Indian American diaspora, as it increases in number and in its influence across sectors of American society, business, and politics, and with its continued rootedness with Indian traditions and family connections in India, is likely to become more important for Indian politicians and political parties.

GREENPLY INDUSTRIES LIMITED
Registered Office: 'Madgul Lounge', 23 Chetla Central Road, 6th Floor, Kolkata - 700 027, West Bengal
Phone: (033) 3051 5000, E-mail: Investors@greenply.com, Website: www.greenply.com, CIN: L20211WB1990PLC268743

NOTICE TO THE SHAREHOLDERS FOR FURNISHING KYC DETAILS

Notice is hereby given with respect to SEBI Master Circular SEBI/HO/MIRSD/POD-1/P/CIR/2024/37 dated 7th May 2024 read with SEBI Circular SEBI/HO/MIRSD/POD-1/P/CIR/2024/81 dated 10th June 2024 ("SEBI Circulars") for updation of PAN linked with Aadhaar, Contact Details (postal address with PIN, Mobile Number and e-mail address), Bank Account Details (Bank Name and Branch, Bank Account Number, MICR, IFSC Code and cancelled cheque), choice of nomination and Specimen Signature ("KYC Details") by the shareholders holding shares in Physical mode. Dividend shall only be paid in electronic mode to such shareholders holding shares in physical form and whose e-mail address, postal address, mobile number, bank account details, PAN linked with Aadhaar and specimen signatures ("KYC Details") are not available with the Company, upon furnishing all the aforesaid details in entirety.

Shareholders of the Company, holding shares of the Company in Physical mode, are requested to submit their KYC details in Form(s) ISR-1, ISR-2, ISR-3, SH-13, SH-14, duly signed along with the required supporting documents, as applicable, to the Registrar and Share Transfer Agent (RTA) of the Company at the address mentioned below:

S. K. Infosolutions Pvt. Ltd.
D/42, Katju Nagar Colony, Ground Floor, Near South City Mall, PO & PS - Jadavpur, Kolkata - 700 032.
Contact No.: 033-24120027 / 033-24120029, Email ID: contact@skcinfo.com/skcdilip@gmail.com

Copies of the above-mentioned forms can be downloaded from the website of the RTA i.e. <http://www.skinfo.in/notice.php> and website of the Company www.greenply.com/investors. Please strike out the portion of the forms which is not applicable to you.

For Greenply Industries Limited
Sd/-
Kaushal Kumar Agarwal
Company Secretary & Vice President-Legal

Place: Kolkata
Dated: 19.09.2024

SHRIRAM MUTUAL FUND
Shriram House, No. 4 Burkit Road, T. Nagar, Chennai - 600 017
Shriram Asset Management Company Limited (Investment Manager)
Registered Office: 217, 2nd Floor, Swastik Chambers, Near Junction of S.T. & C.S.T. Road, Chembur, Mumbai - 400 071. CIN: L65991MH1994PLC079874; Website: www.shriramamc.in

NOTICE-CUM-ADDENDUM No. 10/2024-25

NOTICE-CUM-ADDENDUM TO THE STATEMENT OF ADDITIONAL INFORMATION (SAI) OF SHRIRAM MUTUAL FUND

APPOINTMENT OF MR. SUDIP SURESH MORE AS FUND MANAGER - FIXED INCOME & KEY PERSONNEL OF SHRIRAM ASSET MANAGEMENT COMPANY LIMITED ('the AMC')

NOTICE is hereby given that, Mr. Sudip Suresh More has been appointed as the Fund Manager - Fixed Income of the AMC with effect from September 16, 2024. Accordingly, the following details shall be inserted under the section "Information on Key Personnel of the Asset Management Company" in the SAI of Shriram Mutual Fund:

Name	Designation / Years of experience	Qualification / Age	Experience & Background (during last 10 years)
Mr. Sudip Suresh More	Fund Manager - Fixed Income / 19 years	B.E. (EXTC), MMS (Finance), FRM (Garp Certified) / 44 years	Mr. Sudip has around 19 years of experience in managing Fixed Income Investments, Macroeconomic Research and Credit Analysis. Prior to this assignment, Mr. Sudip was Debt Fund Manager at Kshema General Insurance Company. Additionally, he has also worked with Sahara India Life Insurance Company Ltd as a Debt Fund Manager whereby managing ULIP and Traditional funds on Fixed Income side.

This notice cum addendum forms an integral part of the SAI of Shriram Mutual Fund, read with the addenda issued from time to time.

All other terms and conditions as mentioned in the SAI, read with the addenda issued from time to time, shall remain unchanged.

For Shriram Asset Management Company Limited
(Investment Manager of Shriram Mutual Fund)

Date : September 19, 2024
Place : Mumbai

Sd/-
Authorised Signatory

For more information, please contact **Shriram Asset Management Company Limited**, 511-512, Meadows, Sahar Plaza, J. B. Nagar, Andheri (East), Mumbai - 400 059. Tel: 022 6947 3400, Email: info@shriramamc.in, Website: www.shriramamc.in

Mutual fund investments are subject to market risks, read all scheme related documents carefully.

Aditya Birla Capital Limited

Regd. Office: Indian Rayon Compound, Veraval - 362 266, Gujarat | Tel: 91 2876 243257
CIN: L67120GJ2007PLC058890 | www.adityabirlacapital.com | abc.secretarial@adityabirlacapital.com

NOTICE

FOR THE ATTENTION OF EQUITY SHAREHOLDERS OF THE COMPANY

TRANSFER OF SALE PROCEEDS ARISING FROM SALE OF FRACTIONAL SHARES OF ADITYA BIRLA CAPITAL LIMITED TO INVESTOR EDUCATION AND PROTECTION FUND (IEPF) AND FURNISHING OF PAN AND KYC DETAILS BY HOLDERS OF PHYSICAL SECURITIES

Notice is hereby given to the equity shareholders of the Company that pursuant to the provisions of Section 125 of the Companies Act, 2013 read with the IEPF Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 (Rules), as amended from time to time, the Company is required to transfer the sale proceeds arising from the sale of fractional shares (fractional warrant amount) of Aditya Birla Capital Limited by virtue of the Composite Scheme of Arrangement between Aditya Birla Nuvo Limited, Grasim Industries Limited and Aditya Birla Capital Limited (erstwhile Aditya Birla Financial Services Limited) in respect of which the fractional warrant amount has not been paid or claimed for seven consecutive years from the date of warrant to the IEPF.

The Company has already sent individual communication to the equity shareholders who have not claimed their fractional warrant amount for seven consecutive years, at their address registered with the Company, giving them an opportunity to claim the said unclaimed fractional warrant amount on or before 25th September 2024.

Shareholders may kindly note that the unclaimed fractional warrant amount transferred to IEPF can be claimed by them from IEPF Authority by submitting an online application in the prescribed form IEPF-5 available on the website <https://www.mca.gov.in> in accordance with the procedure and on submission of such documents as prescribed under the IEPF Rules.

Please note that no claim shall lie against the Company in respect of unclaimed fractional warrant amount has been transferred to IEPF.

Further, the Securities and Exchange Board of India vide master circular no. SEBI/HO/MIRSD/POD-1/P/CIR/2024/37 dated 7th May 2024 and SEBI Circular no. SEBI/HO/MIRSD/POD-1/P/CIR/2024/81 dated 10th June 2024 has inter-alia made furnishing of PAN and KYC details i.e. contact details (Postal Address with PIN Code and Mobile Number), Bank A/c details and Specimen signature mandatory by the investors holding shares in physical form.

The Company has already sent individual communication to physical shareholders who have not updated their KYC details with the Company/Registrar & Transfer Agents (RTA) at their registered postal address to furnish the KYC details along with copies of the relevant forms.

Please note that as per SEBI circular, the folios wherein PAN and KYC details are not available, the security holder shall be eligible:

- to lodge grievance or avail any service request from the RTA only after furnishing the PAN and KYC details
- for any payment including dividend in respect of such folios, only through electronic mode with effect from 1st April 2024.

Shareholders holding equity shares of the Company in physical form are also requested to kindly get their equity shares converted into dematerialised form as shares in dematerialised/electronic mode offers several benefits and eliminates risks associated with physical certificates.

For any information/clarifications, please write to abc.secretarial@adityabirlacapital.com or einward.ris@kfnitech.com or at the registered office of the Company/RTA.

For ADITYA BIRLA CAPITAL LIMITED
Sd/-
Santosh Haldankar
Company Secretary and Compliance Officer
ACS - 19201

Place: Mumbai
Date : 19 September, 2024



આજુબુજુ પાંચાંગ

Table with 4 columns: સૂર્યોદય, વાસ્તવશી, સૂર્યાસ્ત, રવિચંદ્ર. Includes details for Navagraha and Rashi forecasts.

આજની રાશિ

Table listing 12 zodiac signs (Rashi) with their corresponding deities, colors, and daily forecasts.

મહેસાણા

Table for Mahesana district with columns for day, date, and weather/forecast.

સુરેકડું

Table for Surekda district with columns for day, date, and weather/forecast.

5638

Table for 5638 district with columns for day, date, and weather/forecast.

સર્વશ્રાદ્ધી શ્રિવત્સ રિડ્રેસલ સેલ ક્યાં સુધીમાં શરૂ કરશે એ કહો : HC 'ટ્રાફિક ઉપરાંત ફુટપાથ, રસ્તા પર દબાણ નિવારવા નક્કર મિકેનિઝમ વિચારો'

સર્વશ્રાદ્ધી શ્રિવત્સ રિડ્રેસલ સેલ ક્યાં સુધીમાં શરૂ કરશે એ કહો : HC 'ટ્રાફિક ઉપરાંત ફુટપાથ, રસ્તા પર દબાણ નિવારવા નક્કર મિકેનિઝમ વિચારો'

આરોપી ચોરીનો મુદ્દામાનો નિકાલ કરે તે પહેલા દબોલી લેવાયો બંભાળિયામાં રૂપિયા ૫૫ લાખની ચોરીના બનાવમાં એક શખસની ધરપકડ

આરોપી ચોરીનો મુદ્દામાનો નિકાલ કરે તે પહેલા દબોલી લેવાયો બંભાળિયામાં રૂપિયા ૫૫ લાખની ચોરીના બનાવમાં એક શખસની ધરપકડ

આંતર રાજ્ય જવાહરલાલ નહેરુ હોકી સ્પર્ધા અંડર-૧૭ બોયઝમાં અમરેલીને હુરાવી દાહોદની ટીમ ચેમ્પિયન

આંતર રાજ્ય જવાહરલાલ નહેરુ હોકી સ્પર્ધા અંડર-૧૭ બોયઝમાં અમરેલીને હુરાવી દાહોદની ટીમ ચેમ્પિયન

લોકોની નહીં પોલીસની માનસિકતા બદલવાની જરૂર

લોકોની નહીં પોલીસની માનસિકતા બદલવાની જરૂર. સરકાર તરફથી એવો ઉભાવ કરવાનો પ્રયાસ થતો હતો કે, ટ્રાફિક-પાલિકાની સમસ્યા હલ કરવામાં લોકોએ પોતા માનસિકતા બદલવાની જરૂર છે.

પોલીસે સોનાની બંગડી, પેન્ડલ, સોડક કબજે કર્યા

પોલીસે સોનાની બંગડી, પેન્ડલ, સોડક કબજે કર્યા. ડાહોડના પોલીસે સોનાની બંગડી, પેન્ડલ, સોડક કબજે કર્યા.

સૌરાષ્ટ્ર યુનિ.એ નેક એકેડેમીએટેડ બદલે તમામ કોલેજના ડેટા મગાવી ટાઈમ-પાસ કર્યો

સૌરાષ્ટ્ર યુનિ.એ નેક એકેડેમીએટેડ બદલે તમામ કોલેજના ડેટા મગાવી ટાઈમ-પાસ કર્યો. સૌરાષ્ટ્ર યુનિ.એ નેક એકેડેમીએટેડ બદલે તમામ કોલેજના ડેટા મગાવી ટાઈમ-પાસ કર્યો.

તેજસ્વી વિદ્યાર્થીઓના ઉત્તમ શિક્ષણ માટે નવી પહેલ રેડિયન્સ સ્કોલરશિપનો પ્રારંભ થશે

તેજસ્વી વિદ્યાર્થીઓના ઉત્તમ શિક્ષણ માટે નવી પહેલ રેડિયન્સ સ્કોલરશિપનો પ્રારંભ થશે. તેજસ્વી વિદ્યાર્થીઓના ઉત્તમ શિક્ષણ માટે નવી પહેલ રેડિયન્સ સ્કોલરશિપનો પ્રારંભ થશે.

યૂનિયન બેંક Union Bank of India

યૂનિયન બેંક Union Bank of India. યૂનિયન બેંક ઓફ ઇન્ડિયા ના અધિકૃત અધિકારીઓએ નિયુક્તિપત્રો આપ્યા છે.